



## વિષય : શિક્ષક શિક્ષણમાં Excellent કેવી રીતે બનાવું ?

અલોશાસ પટેલ  
(ઉ.મા.વિજ્ઞાન પ્રવાહ)

શિક્ષકના મુખ્ય અણ કાર્યો હોય છે. વિદ્યાર્થીઓને પ્રભાવિત કરવાનું, પ્રકાશિત કરવાનું અને પ્રસારિત કરવાનું. સામાન્ય રીતે સરેરાશ શિક્ષક માત્ર ભણાવે છે. સારો શિક્ષક સમજાવે છે. પરંતુ Excellent Teacher વિદ્યાર્થીને પ્રેરિત કરે છે.

**વિષય વસ્તુ વિશ્લેષણ** એટલે વર્ગમાં જે મુદ્દાનો બરાબર અભ્યાસ કરીને તે વર્ગમાં કેવી રીતે અસરકારક અને સરળ રીતે વિદ્યાર્થીઓને સમજાવી શકાય તેનું વિશ્લેષણ.

- એક ચારિઅધ્યાત્મન શિક્ષક જ ચારિઅધ્યાત્મન સમાજનું ઘડતર કરી શકે છે. ચારિઅધ્ય એટલે સંસ્કાર, સજ્જનતા, પ્રમાણિકતા જેવા ગુણોનો સમન્વય.
- આવા શિક્ષક પોતાની સંસ્થા, પોતાના વિદ્યાર્થીઓ અને સમાજ પ્રત્યે પ્રતિબદ્ધ હોવા જોઈએ.
- વર્ગના હોશિયારથી માંડીને નબળા વિદ્યાર્થી, તોફાનીથી માંડીને નબળા વિદ્યાર્થી, હોશિયારથી માંડીને શાંત વિદ્યાર્થીઓને પોતાના વર્ગકાર્ય દરમ્યાન કેમ કાર્યરત રાખી શકાય તેની આવડત શિક્ષકમાં હોવી જોઈએ.

શિક્ષણમાં ઉલ્લંઘણ પ્રાપ્ત કરવા માટે શિક્ષકે, ચારિઅધ્ય, વિષયવસ્તુ, વિષયવસ્તુ વિશ્લેષણ, વર્ગ અંકુશ, પ્રતિબદ્ધતા, પૂર્વગ્રહમુકત જેવી બાબતોનું ગંભીરતાથી ધ્યાન આપવું જોઈએ.



## વિષય : ચિંતાઓને કરો ગુડ બાય જુંદગી કેવી રીતે સારી બનાવી શકાય ?

કુસુમબેન અન.માવર  
(ઉ.મા. વિજ્ઞાનપ્રવાહ)

નાની મોટી ચિંતાઓ જ્યારે અમુક હુદ કરતાં વધે તો તણાવની પરિસ્થિતિ ઊભી થાય અને પરિણામે બીજા પ્રકારની મુશ્કેલીઓ વધે છે.

- માનવી અસ્વસ્થતા તરફ જતો રહે છે, અને જો લાંબો સમય અસ્વસ્થ રહે તો તે માનસિક રોગી પણ બની શકે છે.

### ચિંતાની માનસિક અસરો :

1. સમજશક્તિ ગુમાવે છે. તેથી વ્યક્તિ ડિપ્રેશન તરફ જાય છે.
2. વ્યક્તિ નિરાશાવાદી બને છે.
3. નિર્ણય શક્તિ ઘટે છે.
4. ચિંતા અભિન છે જે વ્યક્તિ ને પોતાને તો બાળે જ છે સાથે તેની અસર બીજાને પણ થાય છે.

### ચિંતાની શારીરિક અસરો :

1. રોગપ્રતિકારકતા શક્તિ ઘટે
2. અનિદ્રા
3. વજનમાં વધ ઘટ થાય
4. વાળ ખરે, ત્વચાને નુકશાન થાય.

જેને ઉડવું છે  
તેને ગગન મળી રહે છે.

### ● ચિંતા મુક્ત રહેવા શું કરી શકાય?

1. એકાગ્રતા વધારવા ઝેં નો જાપ કરી શકાય. પ્રાણાયામ અને ધ્યાન કરતાં શીખવું.
2. તણાવ મુક્ત વાતાવરણમાં રહો.
3. હકારાત્મક વિચારો રાખો.
4. સ્નાયુને આરામ આપો - તે માટે સ્ટ્રેચિંગ, મસાજ, હોટબાથ લઈ શકાય.
5. ટ્રિગર્સથી બચો - ચિંતા માટે જવાબદાર પરિબળોથી દૂર રહો.
6. સત્યનો સ્વીકાર કરો.

### ● પાંચ મિનીટમાં તણાવમુક્ત બનવા :

1. ગ્રીન ટી પીએઓ. તેમાં થિયેનીન નામનું રસાયણ હોય છે. જે ગુસ્સાને શાંત કરે છે.
2. મધ્ય તણાવમુક્ત માટે ઉપયોગી છે.
3. મનગમતા ગીત ગાઓ અથવા સાંભળો.
4. ડાર્ક ચોકલેટનું સેવન કરો. જે કોટિસોલનું પ્રમાણ નિયમિત કરે છે, અને મેટાબોલિઝમ સ્થિર કરે છે.
5. ઊંધી ગળાતરી કરો.
6. ખાટો ફળોનું સેવન કરો.
7. ઓશિકા પર ૫-૧૦ મિનીટ માથું રાખી મગજને આરામ આપો.
8. હારસ્ય થેરાપીનો ઉપયોગ કરો.
9. રજાનો પ્લાન કરો અને મનગમતી જગ્યાએ ફરવા જરૂરું.
10. પ્રકાશિત વિસ્તારમાં રહો. સૂર્યનો પ્રકાશ તણાવમુક્ત રાખે છે.
11. વાળમાં બ્રશ તેમજ મસાજ કરો.
12. દરરોજ ૧૫ થી ૨૦ મિનીટ ચાલવા જરૂરું.
13. મનગમતા મિત્રો સાથે વાતચીત કરો.




## વિષય : જીવન જીવવાની કળા

- જીવનના વિવિધ તબકકાઓ માટે આપણા ઋભિઓએ આપેલ આશ્રમ-વ્યવસ્થા.
- “ધર્મ” વિશે સાચી સમજણ કેળવીને ધર્મચિરણ યુક્ત જીવન.
- વિચાર, વાણી અને વર્તનમાં “આર્થ-વૃત્તિ” કેળવી.
- મજબૂત નૈતિક અને સાંસ્કૃતિક મૂલ્યો સાથેનું જીવન.
- સહજ, દંભ – રહિત કૌઠુંબીક અને સામાજિક સંબંધો બનાવવા.
- ટુંકા ગાળાના અને લાંબા ગાળાના છેચો જરૂરી.
- “અભયમું” કેળવું સ્પષ્ટ અને નિર્ભીક વક્તા બનવું.
- જીવનમાં સફળતાની સાથે નિષ્ફળતા તથા સુખની સાથે દુઃખ આવવાનું જ તેને પચાવતા શીખવું.
- શરીર પ્રભુનું મંદિર છે. તેને સ્વસ્થ, સશક્ત અને સુંદર રાખવું.
- ધન પ્રાપ્તિ સાચા, નૈતિક રસ્તે જ થવી જોઈએ.
- જ્ઞાન પિપાસુ બનવું, જ્ઞાનવાનનો આદર કરવો.
- માનસિક સ્વાસ્થ્ય બાબતે જાગૃત રહી સશક્ત મન બનાવવું.
- આર્થિક આચ્યોજન કરવું જરૂરી.
- “સ્વયં પ્રેરીત” બનવું બાધ્ય પ્રેરણાઓ લાંબો સમય ટક્કતી નથી.
- માત્ર મુશ્કેલીના સમયમાં જ નહીં, સુખના અને સફળતાના સમય દરમાન પણ ઇંઘર શરણમાં રહેવું.

જ્યોતિબેન મજિઠિયા

(ઉ.મા.)

વિજ્ઞાન પ્રવાહ)



જી એટલે જીવવું
વ એટલે વધવું
ન એટલે નમ્ર રહેવું



## વિષય : શ્રી અરવિંદ અને રવિન્દ્રનાથ ટાગોરની જીવનમાં ફિલોસોફી

### સુહેલભાઈ ભરયી

(ઉ.મા. વિજ્ઞાન પ્રવાહ)

રવિન્દ્રનાથ ટાગોર ભારતના મહાન કવિ, સાહિત્યકાર, ચિંતક અને દાર્શનિક હતા. તેમનો જન્મ ૭ મે ૧૮૬૧ના રોજ કોલકતામાં એક સમૃદ્ધ અને સાહિત્યપ્રેરીતી બાધ્યણ પરિવારમાં થયો હતો. અને તેમનું અવસાન ૭ ઓગસ્ટ ૧૯৪১માં થયું હતું.

### રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણમાં તત્વજ્ઞાનના મુખ્ય પાસાઓ :

- |                                   |                       |
|-----------------------------------|-----------------------|
| ૧. મનુષ્યના પુર્ણ વિકાસની દ્રષ્ટિ | ૨. સહજગત શિક્ષણ       |
| ૩. પ્રકૃતિ સાથે સુમેળ             | ૪. અંતરાત્માની મુક્તિ |
| ૫. શ્રોતા અને વ્યવહાર             | ૬. આંતરાધ્રીય એકતા    |

**શ્રી અરવિંદ ધોપ :** ભારતના મહાન દાર્શનિક, રાધીય વીર, કાંતિકારી અને આદ્યાત્મિક નેતા. તેમનો જન્મ ૧૫ ઓગસ્ટ, ૧૮૭૨ના રોજ કલકતામાં થયો હતો. તેમનું અવસાન પ ડિસેમ્બર, ૧૯૫૦ના રોજ પોડીચેરીમાં થયું હતું.

### શ્રી અરવિંદ ધોપનું શિક્ષણમાં તત્વજ્ઞાનના મુખ્ય પાસાઓ:

- |   |                                    |
|---|------------------------------------|
| ૧. શારીરિક, માનસિક અને આદ્યાત્મિક વિકાસ | ૩. સહજગત વિદ્યાનોનું પ્રોત્સાહન    |
| ૨. અદ્યાત્મ અને અંતરજ્ઞાન               | ૫. સ્વાર્થ અને અહીમત્વથી મુક્તિ    |
| ૪. શિક્ષણનો અખંડ વિકાસક્રમ              | ૬. માનવતાવાદ અને પેશ્વકતાની દૃષ્ટિ |

### ભારતમાં કુદરતી શિક્ષણ આપ્તી સંસ્થાઓ :

૧. શાંતિનિકેતન ( વિશ્વભારતી યુનિવર્સિટી), પશ્ચિમ બંગાલ
૨. આરતી વિદ્યાલય, તામિલનાડુ
૩. અરવિંદ ઇન્ટરનેશનલ સ્કૂલ, પોન્ડિચેરી
૪. The School, Krishna Murti Foundation
૫. સ્ટાર ગાંધીવ વિદ્યાલય, મહારાષ્ટ્ર



### હું શિક્ષક

હું શિક્ષક,  
મારી શાળા જ મારો દેહ,  
ને બાળકો મારું હૃદય... !  
મારું મન- હૃદય અને દેહ,  
શિક્ષકત્વનો ભેખ ધારી.

મારા શ્રાસમાં,  
દબકતું શિક્ષકત્વ લઈ,  
હું દોડી જાઉ વર્ગંડમાં,  
ને જ્યાં નીરખું હાલા બાળકોને,  
ત્યાં આનંદ અનેરો,  
છલકે મુજ ચહેરે.... !  
એ આનંદના છાંટણે,  
ખીલે બાળપુષ્પો,  
ને બને વર્ગ મારો બગીચો.... !  
મન-હૃદયમાંથી વહેતી  
શાંદ ગંગા

ચોક – પેનથી રચે  
ગીત મધૂરા... !

મારી મુડી મારી શાળા  
ને મારા બાળકો.... !

હું શિક્ષક  
કરું બાળકોને શિક્ષિત  
અને દિક્ષિત.

શિક્ષણ જ  
મારું કર્મ મારો ધર્મ  
આજીવન હું શિક્ષક